



સિદ્ધાંત ૬૬

Joshe Imani (Gujarati)

જોશે ઈમાની

શ્રીમે તરીકત, અમીરે અહલે સુલત, બાજિયે દા'પતે ઉસ્લામી, હાસ્તે અલ્લામા મીલાલા અબુ ઝિલાલ

મુહમ્મદ ઈલ્વાસ અત્તાર કાદિરી ર-ઝવી

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
أَتَابَعُدُّ وَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

કિતાબ પઢને કી દુઆ

અજ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી, હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ દીની કિતાબ યા ઈસ્લામી સબક પઢને સે પહલે જૈલ મેં દી હુઈ દુઆ પઢ લીજિયે إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ જો કુછ પઢેંગે યાદ રહેગા. દુઆ યેહ હે :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَأَنْشُرْ
عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

તરજમા : ઐ અલ્લાહ عَزَّوَجَلَّ ! હમ પર ઈલ્મો હિક્મત કે દરવાજો ખોલ દે ઔર હમ પર અપની રહમત નાઝિલ ફરમા ! ઐ અ-ઝમત ઔર બુઝુર્ગી વાલે । (المستطرف ج ١، دار الفكر بيروت)
નોટ : અવ્વલ આખિર એક એક બાર દુરુદ શરીફ પઢ લીજિયે.

તાલિબે ગમે મદીના
વ બકીઅ
વ મગિરત
13 શવ્વાલુલ મુકર્રમ 1428 હિ.



જોશો ઈમાની

યેહ રિસાલા (જોશો ઈમાની)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી ઝિયાઈ دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ ને ઉર્દૂ ઝબાન મેં તહરીર ફરમાયા હે.

મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી) ને ઈસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ ક્રિયા હે ઔર મક-ત-બતુલ મદીના સે શાએઅ કરવાયા હે. ઈસ મેં અગર કિસી જગહ કમી બેશી પાએં તો મજલિસે તરાજિમ કો (બ ઝરીઅએ મક્તૂબ, ઈ-મેઇલ યા SMS) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઈયે.

રાબિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)

મક-ત-બતુલ મદીના, સિલેક્ટેડ હાઉસ, અલિફ કી મસ્જિદ કે સામને,
તીન દરવાજા, અહમદઆબાદ-1, ગુજરાત, ઈન્ડિયા

MO. 9374031409 E-mail : translationmaktabhind@dawateislami.net

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
 مَا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

જોશો ઈમાની¹

ગાલિબન આપ કો શૈતાન યેહ રિસાલા (23 સફહાત)
 પૂરા નહીં પઢને દેગા મગર આપ કોશિશ કર કે પૂરા
 પઢ કર શૈતાન કે વાર કો નાકામ બના દીજિયે.

દુરુદ શરીફ કી ફઝીલત

“સઆ-દતુદારૈન” મેં હે, હઝરતે સચ્ચિદુના ઈબ્રાહીમ બિન
 અલી બિન અતિય્યા عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى ફરમાતે હેં : મેં ને ખ્વાબ મેં જનાબે
 રિસાલત મઆબ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા દીદાર ક્રિયા તો અર્ઝ કી :
 સરકાર ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ આપ કી શફાઅત કા તલબ ગાર હૂં.
 સરકાર صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને ફરમાયા : يَا أَكْثَرَ مِنَ الصَّلَاةِ عَلَيَّ
 “મુઝ પર કસરત કે સાથ દુરુદે પાક પઢા કરો.” (سعادة الآارين ص 127)

કા'બે કે બદરુદુજા તુમ પે કરોડોં દુરુદ

તયબા કે શમ્સુદુહા તુમ પે કરોડોં દુરુદ

(હદાઈકે બખ્શિશ શરીફ, સ. 364)

صَلُّوا عَلَيَّ الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

¹ : યેહ બયાન અમીરે અહલે સુન્નત صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને તબ્લીગે કુરઆનો સુન્નત કી
 આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કે ત્રીન રોઝા બૈનલ અક્વામી
 સુન્નતોં ભરે ઈજતિમાઅ (2,3,4 ર-જબુલ મુરજજબ 1419 સિ.હિ. મદીનતુલ ઔલિયા
 મુલતાન) કી આખિરી નિશસ્ત મેં ફરમાયા. તરમીમ વ ઈઝાફે કે સાથ તહરીરન
 હાઝિરે બિદમત હે.
 -મજલિસે મક-ત-બતુલ મદીના

ફરમાને મુસ્તફા ﷺ : جَسَى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَاللّٰهُ وَاسْتَمَّ : जिस ने मुझ पर एक बार दृष्टि पाक पढा अदलाउ उस पर दस
रहमतें भेजता है. (स्म)

મ-દની મુન્ને કા જોશે ઈમાની

રાત કા પિછલા પહર થા, સારે કા સારા મદીના નૂર મેં ડૂબા હુવા થા. અહલે મદીના રહમત કી ચાદર ઓઢે મહૂવે ખ્વાબ થે, ઈતને મેં મુઅઝ્ઝને રસૂલુલ્લાહ હઝરતે સચ્ચિદુના બિલાલે હબશી رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કી પુરકૈફ સદા મદીનએ મુનવ્વરહ رَادَهَا اللهُ شَرَفًا وَتَعْظِيمًا કી ગલિયોં મેં ગૂંજ ઉઠી : “આજ નમાઝે ફજ કે બા’દ મુજાહિદીન કી ફૌજ એક અઝીમ મુહિમ પર રવાના હો રહી હૈ. મદીનએ મુનવ્વરહ رَادَهَا اللهُ شَرَفًا وَتَعْظِيمًا કી મુકદ્દસ બીબિયાં અપને શહઝાદોં કો જન્નત કા દૂલ્હા બના કર ફૌરન દરબારે રિસાલત મેં હાઝિર હો જાએ.” એક બેવા સહાબિયા હૈયા અપને ૯⁶ સાલહ યતીમ શહઝાદે કો પહલૂ મેં લિટાએ સો રહી થીં. હઝરતે સચ્ચિદુના બિલાલ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કા એ’લાન સુન કર ચોંક પડી ! દિલ કા ઝખ્મ હરા હો ગયા, યતીમ બચ્ચે કે વાલિદે ગિરામી ગુઝશ્તા બરસ ગઝ્વએ બદ્ર મેં શહીદ હો ચુકે થે. એક બાર ફિર શ-જરે ઈસ્લામ કી આબ-યારી કે લિયે ખૂન કી ઝરૂરત દરપેશ થી મગર ઈન કે પાસ ૯⁶ સાલહ મ-દની મુન્ને કે ઈલાવા કોઈ ઔર ન થા. સીને મેં થમા હુવા તૂફાન આંખોં કે ઝરીએ ઉમંડ આયા. આહોં ઔર સિસ્કિયોં કી આવાઝ સે મ-દની મુન્ને કી આંખ ખુલ ગઈ, માં કો રોતા દેખ કર બે કરાર હો કર કહને લગા : માં ! ક્યૂં રોતી હો ? માં મ-દની મુન્ને કો અપને દિલ કા દર્દ કિસ તરહ સમઝાતી ! ઉસ કે રોને કી આવાઝ મઝીદ તેઝ હો ગઈ. માં કી ગિર્યા વ ઝારી કે તઅસ્સુર સે મ-દની મુન્ના ભી રોને લગ ગયા. માં ને મ-દની મુન્ને કો બહલાના શુરૂઅ કિયા, મગર વોહ માં કા દર્દ જાનને કે લિયે બઝિદ થા. આખિર કાર માં ને અપને જઝબાત

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : (उस शप्स की नाक पाक आलूद हो जिस के पास मेरा जिंक हो और वोह मुज पर दुर्रदे पाक न पढे. (त्रमदी)

પર બ કોશિશ તમામ કાબૂ પાતે હુએ કહા : બેટા ! અભી અભી હઝરતે સય્યિદુના બિલાલ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ ને એ'લાન ક્રિયા હૈ : મુજાહિદીન કી ફૌજ મૈદાને જંગ કી તરફ રવાના હો રહી હૈ. આકાએ નામદાર صَلَّی اللہُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને અપને જાં નિસાર તલબ ફરમાએ હૈં. કિતની બખ્ત બેદાર હૈં વોહ માએં જો આજ અપને નૌ જવાન શહઝાદોં કા નઝરાના લિયે દરબારે રિસાલત મેં હાઝિર હો કર અશકબાર આંખોં સે ઇલ્તિજાએં કર રહી હોંગી : યા રસૂલલ્લાહ صَلَّی اللہُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ! હમ અપને જિગર પારે આપ કે કદમોં પર નિસાર કરને કે લિયે લાઈ હૈં, આકા ! હમારે અરમાનોં કી હકીર કુરબાનિયાં કબૂલ ફરમા લીજિયે, સરકાર ! ઉમ્ર ભર કી મેહનત વુસૂલ હો જાએગી. ઇતના કહ કર માં એક બાર ફિર રોને લગી ઓર ભરઈ હુઈ આવાઝ મેં કહા : કાશ ! મેરે ઘર મેં ભી કોઈ જવાન બેટા હોતા ઓર મેં ભી અપના નઝરાનએ શૌક લે કર આકા કી બારગાહ મેં હાઝિર હો જાતી. મ-દની મુન્ના માં કો ફિર રોતા દેખ કર મચલ ગયા ઓર અપની માં કો ચુપ કરવાતે હુએ જોશે ઈમાની કે જઝબે કે સાથ કહને લગા : મેરી પ્યારી માં ! મત રો, મુઝી કો પેશ કર દેના. માં બોલી : બેટા ! તુમ અભી કમસિન હો, મૈદાને કારઝાર મેં દુશ્મનાને ખૂંખાર સે પાલા પડતા હૈ, તુમ તલવાર કી કાટ બરદાશત નહીં કર સકોગે. મ-દની મુન્ને કી ઝિદ કે સામને બિલ આબિર માં કો હથિયાર ડાલને હી પડે. નમાઝે ફજ કે બા'દ મસ્જિદુન્ન-બવિયિયશશરીફ صَلَّی اللہُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કે બાહર મૈદાન મેં મુજાહિદીન કા હુજૂમ હો ગયા. ઉન સે ફારિગ હો કર સરકારે મદીના صَلَّی اللہُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ વાપસ તશરીફ લા હી રહે થે કે એક પર્દા પોશ ખાતૂન પર નઝર પડી જો અપને છ⁶

ફરમાને મુસ્તફા: صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ: જો મુઝ પર દસ મરતબા દુરૂદ પાક પઢે અલ્લાહ ઊંચ પર સો રહમતે નાઝિલ ફરમાતા હૈ. (ખુરૂન)

સાલહ મ-દની મુન્ને કો લિયે એક તરફ ખડી થી. શાહે શીરી મકાલ, સાહિબે જૂદો નવાલ, શહન્શાહે ખુશ ખિસાલ, મહબૂબે રબ્બે ઝુલ જલાલ, આકાએ બિલાલ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને હઝરતે સય્યિદુના બિલાલ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ કો આમદ કા સબબ દરયાફત કરને કે લિયે ભેજા. સય્યિદુના બિલાલ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ ને કરીબ જા કર નિગાહેં ઝુકાએ આને કી વજહ દરયાફત કી. ખાતૂન ને ભરઈ હુઈ આવાઝ મેં જવાબ દિયા : આજ રાત કે પિછલે પહર આપ એ'લાન કરતે હુએ મેરે ગરીબ ખાને કે કરીબ સે ગુઝરે થે, એ'લાન સુન કર મેરા દિલ તડપ ઉઠા. આહ ! મેરે ઘર મેં કોઈ નૌ જવાન નહીં થા જિસ કા નઝરાનએ શૌક લે કર હાઝિર હોતી ફકત મેરી ગોદ મેં યેહી એક છ⁶ સાલહ યતીમ બચ્યા હૈ જિસ કે વાલિદ ગુઝશતા સાલ ગઝવએ બદ્ર મેં જામે શહાદત નોશ કર ચુકે હૈં મેરી ઝિન્દગી ભર કી પૂંજી યેહી એક બચ્યા હૈ, જિસે સરકારે આલી વકાર صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કે કદમોં પર નિસાર કરને કે લિયે લાઈ હૂં. હઝરતે સય્યિદુના બિલાલ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ ને પ્યાર સે મ-દની મુન્ને કો ગોદ મેં ઉઠા લિયા ઓર બારગાહે રિસાલત મેં પેશ કરતે હુએ સારા માજરા અર્ઝ કિયા. સરકાર صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને મ-દની મુન્ને પર બહુત શફકત ફરમાઈ. મગર કમસિની કે સબબ મૈદાને જિહાદ મેં જાને કી ઈજાઝત ન દી. (માખૂઝ અઝ : ઝુલ્ફો ઝન્હર, સ. 222) અલ્લાહ عَزَّ وَجَلَّ કી ઉન પર રહમત હો ઓર ઉન કે સદકે હમારી બે હિસાબ મઝિરત હો.

أَمِينِ بِجَاهِ النَّبِيِّ الْأَمِينِ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

صَلُّوا عَلَيَّ الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्दे पाक न पड़ा तबकीक वोड भद्र भप्त हो गया. (हिन)

દુન્યા કે લિયે તો વક્ત હૈ મગર.....

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! દેખા આપ ને મ-દની મુન્ને કા જોશે ઈમાની ! અલ્લાહ ! અલ્લાહ ! પહલે કી માએ અલ્લાહ વ રસૂલ
عَزَّوَجَلَّ وَصَلَّى اللّٰهُ تَعَالَى عَلَيْهِ وَاٰلِهِ وَسَلَّمَ और દીને ઈસ્લામ સે કિસ કદર વાલિહાના
મહબ્બત કરતી થીં. જો લોગ અપને જિગર પારોં કો બે વફા દુન્યા કી
દૌલત કે હુસૂલ કી ખાતિર અપને શહૂર સે દૂસરે શહૂર બલ્કે દૂસરે મુલક
તક મેં ઓર વોહ ભી બરસોં કે લિયે ભેજને કે લિયે તય્યાર હો જાતે હૈં
મગર અપને હી શહૂર મેં હોને વાલે દા'વતે ઈસ્લામી કે હફ્તાવાર સુન્નતોં
ભરે ઈજતિમાઅ મેં થોડી દેર કે લિયે ભી જાને સે રોક દેતે હૈં, સુન્નતોં કી
તરબિય્યત કી ખાતિર મ-દની કાફિલોં મેં આશિકાને રસૂલ કે હમરાહ
ચન્દ રોઝ સફર કરને સે માનેઅ હોતે હૈં, ઉન કો ઈસ ઈમાન અફરોઝ
હિકાયત સે દર્સે ઈબ્રત હાસિલ કરના ચાહિયે. આહ ! હમ થોડે સે વક્ત
કી કુરબાની દેને સે ભી કતરાતે હૈં ઓર હમારે અસ્લાફ અપના જાન વ
માલ સબ કુછ રાહે ખુદા عَزَّوَجَلَّ મેં કુરબાન કરને કે લિયે હર પલ તય્યાર
રહતે થે.

થે તો આબા વોહ તુમ્હારે હી મગર તુમ કયા હો

હાથ પર હાથ ધરે મુન્તઝિરે ફર્દા¹ હો

صَلُّوْا عَلَيَّ الْحَبِيْبِ ! صَلَّی اللّٰهُ تَعَالَى عَلَیْ مُحَمَّدٍ

1 : ફર્દા : યા'ની આને વાલા દિન.

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्इद शरीफ न पढा उस ने जफ़ा की. (عبدالرزاق)

બદો ઓર જબ તુમ દેખો કે લડાઈ ઝોર પર આ ગઈ ઓર ઈસ કે શો'લે ભડકને લગે હૈં તો ઉસ શો'લા ઝન આગ મેં કૂદ જાના, કાફિરોં કે સરદાર કા મુકાબલા કરના, اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ ઈઝ્ઝતો ઈકરામ કે સાથ જન્નત મેં રહોગે." જંગ મેં હઝરતે સચ્ચિ-દતુના ખન્સાઅ رَضِيَ اللّٰهُ تَعَالٰی عَنْهَا કે ચારોં શહાદોં ને બઢ ચઢ કર કુફર કા મુકાબલા ક્રિયા ઓર યકે બા'દ દીગરે જામે શહાદત નોશ કર ગએ. જબ ઉન કી વાલિદએ મોહ-ત-રમા رَضِيَ اللّٰهُ تَعَالٰی عَنْهَا કો ઉન કી શહાદત કી ખબર પહોંચી તો ઉન્હોં ને બજાએ વાવેલા મયાને કે કહા : ઉસ પ્યારે અલ્લાહ عَزَّوَجَلَّ કા શુક હૈ જિસ ને મુઝે ચાર શહીદ બેટોં કી માં બનને કા શરફ અતા ફરમાયા. મુઝે અલ્લાહુ રબ્બુલ ઈઝ્ઝત કી રહમત સે ઉમ્મીદ હૈ કે મેં ભી ઉન ચારોં શહીદોં કે સાથ જન્નત મેં રહુંગી.

(أَسْدُ الْغَابَةِ فِي مَعْرِفَةِ الصَّحَابَةِ ج ٧ ص ١٠٠-١٠١)

ગુલામાને મુહમ્મદ જાન દેને સે નહીં ડરતે

યેહ સર કટ જાએ યા રહ જાએ કુછ પરવા નહીં કરતે

અલ્લાહ عَزَّوَجَلَّ કી ઉન પર રહમત હો ઓર ઉન કે સદકે હમારી બે હિસાબ મગ્ફિરત હો.

أَمِينِ بِجَاهِ النَّبِيِّ الْأَمِينِ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

صَلُّوْا عَلَيَّ الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

ગુફ્તાર કે ગાઝી

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! આખિર વોહ કૌન સા જઝબા થા જિસ ને હર મર્દ વ ઓરત બલકે બચ્ચે બચ્ચે કો ઈસ્લામ કા શૈદાઈ બના દિયા થા. વોહ કામિલુલ ઈમાન મોમિન થે, વોહ જોશે ઈમાની કે જઝબે સે સરશાર થે ઓર આહ ! આજ કા મુસલ્માન અકસર કમઝોરિયે

ફરમાને મુસ્તફા : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો મુઝ પર રોઝે જુમુઆ દુરૂદ શરીફ પઢેગા મેં કિયામત કે દિન ઉસ કી શકાઅત કરૂંગા. (جمع الجوامع)

ઈમાન કા શિકાર હૈ. ઉન કે પેશે નઝર હર દમ અલ્લાહ વ રસૂલ
 عَزَّوَجَلَّ وَصَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કી રિઝા હુવા કરતી થી મગર હાએ અફસોસ !
 આજ કે મુસલમાનોં કી અક્સરિય્યત કી અબ ઈસ તરફ કોઈ તવજજોહ
 નહીં. વોહ અલ્લાહ વ રસૂલ عَزَّوَجَلَّ وَصَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કી મહબ્બત સે
 સરશાર થે ઓર વાએ બદ નસીબી ! આજ કે મુસલમાનોં કી ભારી
 અક્સરિય્યત દુન્યા કી મહબ્બત મેં મુસ્તગરક હૈ. વોહ આ'લા કિરદાર કે
 માલિક હુવા કરતે થે મગર આજ કે અક્સર મુસલમાન ફક્ત ગુફતાર
 (યા'ની બાતોં) કે ગાઝી બન કર રહ ગએ હૈં. આહ ! સદ હઝાર આહ !
 હમ ને દુન્યા કી મહબ્બત મેં ડૂબ કર, રિઝાએ ઈલાહી કે કામોં સે દૂર હો
 કર, અપની ઝિન્દગિયોં કો ગુનાહોં સે આલૂદ કર કે, અપને મીઠે મીઠે
 આકા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કી પ્યારી પ્યારી સુન્નતોં કે સાંચે મેં ખુદ કો
 ઢાલને કે બજાએ અગ્યાર કે ફેશન કો અપના કર અપની હાલત ખુદ
 આપ બિગાડ ડાલી હૈ. પારહ 13 સૂ-રતુરા'દ કી ગ્યારહવીં આયત મેં
 ઈશાદિ હોતા હૈ :

إِنَّ اللَّهَ لَا يُغَيِّرُ مَا بِقَوْمٍ
 حَتَّىٰ يُغَيِّرُوا أُمُورًا أَنفُسِهِمْ

તર-જ-મએ કન્ઝુલ ઈમાન : બેશક
 અલ્લાહ કિસી કૌમ સે અપની ને'મત
 નહીં બદલતા જબ તક વોહ ખુદ અપની
 હાલત ન બદલ દેં.

અફસોસ ! સદ હઝાર અફસોસ ! બે અ-મલી કે સબબ હમ
 ઝિલ્લતો રુસ્વાઈ કે અમીક ગઢે મેં નિહાયત હી તેઝી કે સાથ ગિરતે ચલે
 જા રહે હૈં. એક વક્ત વોહ થા જબ કુફર મુસલમાન કે નામ સે લરઝા
 બર અન્દામ હો જાયા કરતે થે ઓર આજ ઈન્કિલાબે મા'કૂસ ને મુસલમાનોં
 કો કુફર સે ખૌફઝદા કર રખા હૈ.

ફરમાને મુસ્તફા : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्इद पाक न पढा उस ने जन्नत का रास्ता छोड दिया. (फ़रान)

ઐ ખાસએ ખાસાને રુસુલ વક્તે દુઆ હૈ
જો દીન બડી શાન સે નિકલા થા વતન સે
જિસ દીન કે મદૂગિ થે કત્બી કૈસરો કિસ્રા
વોહ દીન હુઈ બઝમે જહાં જિસ સે ફરૂઝાં
જિસ દીન કી હુજૂત સે સબ અદ્યાન થે મગલૂબ
છોટોં મેં ઈતાઅત હૈ ન શફકત હૈ બડોં મેં
ગો કૌમ મેં તેરી નહીં અબ કોઈ બડાઈ
ડર હૈ કહીં યેહ નામ ભી મિટ જાએ નઆબિર
વોહ કૌમ, કે આફ્રક મેં જો સર બ ફલક થી
જો કૌમ કે માલિક થી ઉલૂમ ઔર હિકમ કી
ખોજ ઉન કે કમાલાત કા લગતા હૈ અબ ઈતના
જો કુછ હૈં વોહ સબ અપને હી હાથોં કે હૈં કરતૂત
દેખે હૈં યેહ દિન અપની હી ગફલત કી બદૌલત
ફરિયાદ હૈ ! ઐ કશિતયે ઉમ્મત કે નિગહૂબાં !
ઐ યશ્મએ રહમત و اُمِّي بَابِي
જિસ કૌમ ને ઘર ઔર વતન તુઝ સે છુડાયા
સો બાર તેરા દેખ કે અફવ ઔર તરહૂહમ
બરતાવ તેરે જબ કે યેહ આ'દા સે હૈં અપને
કર હક સે દુઆ ઉમ્મતે મહૂમ કે હક મેં
ઉમ્મત મેં તેરી નેક ભી હૈં બદ ભી હૈં લેકિન
ઈમાં જિસે કહતે હૈં અકીદે મેં હમારે

ઉમ્મત પે તેરી આ કે અજબ વક્ત પડા હૈ
પરદેસ મેં વોહ આજ ગરીબુલ ગુ-રબા હૈ
ખુદ આજ વોહ મેહમાન સરાએ ફુ-કરા હૈ
અબ ઉસ કી મજાલિસ મેં ન બત્તી ન દિયા હૈ
અબ મો'તરિઝ ઉસ દીન પે હર હર ઝહ સરા હૈ
પ્યારોં મેં મહબબત હૈ ન યારોં મેં વફા હૈ
પર નામ તેરી કૌમ કા યાં અબ ભી બડા હૈ
મુદત સે ઈસે દૌરે ઝમાં મૈટ રહા હૈ
વોહ યાદ મેં અસ્લાફ કે અબ રૂ બ કઝા હૈ
અબ ઈલ્મ કા વાં નામ ન હિકમત કા પતા હૈ
ગુમ દશત મેં ઈક કાફિલા બે ત-બલો દરા હૈ
શિકવા હૈ ઝમાને કા ન કિસ્મત કા ગિલા હૈ
સચ હૈ કે બુરે કામ કા અન્જામ બુરા હૈ
બેડા યેહ તબાહી કે કરીબ આન લગા હૈ
દુન્યા પે તેરા લુત્ફ સદા આમ રહા હૈ
જબ તૂને કિયા નેક સુલૂક ઉન સે કિયા હૈ
હર બાગી વ સરકશ કા સર આબિર કોઝુકા હૈ
આ'દા સે ગુલામોં કો કુછ ઉમ્મીદ સિવા હૈ
ખતરોં મેં બહુત ઈસ કા જહાઝ આ કે ઘિરા હૈ
દિલદાદા તેરા એક સે એક ઈન મેં સિવા હૈ
વોહ તેરી મહબબત તેરી ઈતરત કી વિલા હૈ

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : મુઝ પર દુરુદ પાક કી કસરત કરો બેશક તુમ્હારા મુઝ પર દુરુદ પાક પઢના
તુમ્હારે લિયે પાકીઝગી કા બાઈસ હૈ. (بریسلی)

જો ખાક તેરે દર પે હૈ જારૂબ સે ઉડતી વોહ ખાક હમારે લિયે દારૂએ શિક્કા હૈ
જો શહૂર હુવા તેરી વિલાદત સે મુશરફ અબ તક વોહી કિબ્લા તેરી ઉમ્મત કા રહા હૈ
જિસ શહૂર ને પાઈ તેરી હિજરત સે સઆદત મકકે સે કશિશ ઉસ કી હર ઈક દિલ મેં સિવા હૈ
કલ દેખિયે પેશ આએ ગુલામોં કો તેરે ક્યા અબ તક તો તેરે નામ પે એક એક ફિદા હૈ
હમ નેક હૈં યા બદ હૈં ફિર આબિર હૈં તુમ્હારે નિસ્બત બહુત અચ્છી હૈ અગર હાલ બુરા હૈ
તદબીર સંબલને કી હમારે નહીં કોઈ હાં એક દુઆ તેરી કે મકબૂલે ખુદા હૈ
ખુદ જાહ કે તાલિબ હૈં ન ઈઝઝત કે હૈં ખ્વાહાં
પર ફિક તેરે દીન કી ઈઝઝત કી સદા હૈ

صَلُّوْا عَلَی الْحَبِیْب! صَلَّی اللہُ تَعَالٰی عَلَی مُحَمَّد

એહસાસે ઝિમ્માદારી પૈદા કીજિયે

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! નિહાયત હી સન્જી-દગી કે સાથ
અપને કિરદાર કા જાએઝા લીજિયે. અપને ગુનાહોં સે સચ્ચી તૌબા
કીજિયે ઔર અપને અન્દર અઝ સરે નૌ જોશે ઈમાની પૈદા કીજિયે ઔર
યેહ મ-દની સોચ બનાઈયે કે મુઝે અપની ઔર સારી દુન્યા કે લોગોં કી
ઈસ્લાહ કી કોશિશ કરની હૈ, اِنْ شَاءَ اللہُ عَزَّوَجَلَّ. અગર આપ ને અપની
ઝિમ્માદારી કો સમઝ કર અલ્લાહ વ રસૂલ صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કી
મહબ્બત મેં રૂબ કર ઈસ મ-દની કામ કા બીડા ઉઠા¹ લિયા તો અલ્લાહ
વ રસૂલ صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કે પ્યાર કી બ-ર-કત સે اِنْ شَاءَ اللہُ عَزَّوَجَلَّ
આપ કા દોનોં જહાં મેં બેડા પાર હોગા.

હમ કો અલ્લાહ ઔર નબી સે પ્યાર હૈ

اِنْ شَاءَ اللہُ અપના બેડા પાર હૈ

(વસાઈલે બખ્શિશ, સ. 600)

¹ : બીડા ઉઠાના : યા'ની આમાદા હોના.

કરમાને મુસ્તફા : صلى الله تعالى عليه و آله وسلم : जिस के पास मेरा जिक्र हो और वोह मुज पर दुरद शरीफ न पढे तो वोह लोगों में से कन्जूस तरीन शप्स है. (مسند احمد)

મ-દની કાફિલે મેં શિક્ષા ભી મિલી ઓર દીદાર ભી હુવા

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! الْحَمْدُ لِلَّهِ عَزَّوَجَلَّ દા'વતે ઈસ્લામી કે સુન્નતોં કી તરબિય્યત કે મ-દની કાફિલોં મેં આશિકાને રસૂલ કી સોહબત કી બ-ર-કત સે દુન્યા વ આખિરત કી ઐસી ઐસી સઆદતેં મિલતી હેં કે ન પૂછો બાત. આપ કી તરગીબ કે લિયે એક મ-દની બહાર આપ કે ગોશ ગુઝાર કરતા હૂં યુનાન્યે પાકિસ્તાન કે સૂબા પંજાબ કે એક ઈસ્લામી ભાઈ કા બયાન હૈ : મેં દા'વતે ઈસ્લામી કે આલમી મ-દની મર્કઝ ફૈઝાને મદીના (બાબુલ મદીના કરાચી) મેં “તરબિય્યતી કોર્સ” કે લિયે આયા હુવા થા, ઈસ દૌરાન એક દિન જુમા'રાત કો સુબહ તકરીબન ચાર બજે પેટ કી બાઈ જાનિબ અચાનક દર્દ ઉઠા, દર્દ ઈસ કદર શદીદ થા કે સાત ઈન્જેક્શન લગે તબ આરામ આયા, હસ્બે મા'મૂલ જુમા'રાત કો હોને વાલે સુન્નતોં ભરે ઈજતિમાઅ કે લિયે (મ-દની મર્કઝ ફૈઝાને મદીના) મેં શામ કો હાઝિર હુવા. રાત દસ બજે ફિર દર્દ શુરૂઅ હુવા મગર ઈજતિમાઅ મેં માંગી જાને વાલી ઈજતિમાઈ દુઆ કે વક્ત ઠીક હો ગયા, એક ઘન્ટે કે બા'દ ફિર બહુત શદીદ દર્દ ઉઠા. ડોક્ટર ને ત્રીન ઈન્જેક્શન લગાએ ફિર કુછ ઈફાકા હુવા. અબ હાલત યેહ હો ગઈ કે જબ ભી ખાના ખાતા દર્દ શુરૂઅ હો જાતા. રોઝાના ત્રીન ચાર ટીકે લગતે. ડ્રિપ ચઢતી, અલ્ટ્રા સાઉન્ડ ભી કરવાયા, મગર ડોક્ટરોં કો દર્દ કા સબબ સમઝ મેં ન આયા. મેં અસ્પતાલ મેં પડા થા વહાં મુઝે મા'લૂમ હુવા કે મેરે સાથ વાલે ઈસ્લામી ભાઈ સુન્નતોં કી તરબિય્યત કે મ-દની કાફિલે મેં 12 દિન કે લિયે સફર કી તય્યારી કર રહે હેં, ડોક્ટર ને સફર સે બહુતેરા રોકા મગર મુઝ સે ન રહા ગયા મેં ડેરા બુગટી (બલોચિસ્તાન) જાને વાલે મ-દની કાફિલે કા મુસાફિર બન ગયા. ડેરા બુગટી જાતે હુએ

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : تুম જહાં ભી હો મુજ પર દુરુદ પઢો કે તુમહારા દુરુદ મુજ તક પહોચતા હૈ. (ખરન.)

રાસ્તે મેં થોડા સા દર્દ હુવા, ફિર વહાં સે હમ ને “સૂઈ” આ કર જુમા’રાત કે સુન્નતોં ભરે ઈજતિમાઅ મેં શિર્કત કી ઓર ફિર ડેરા બુગટી વાપસ આ ગએ. اَلْحَمْدُ لِلّٰہِ મ-દની કાફિલે કી બ-ર-કત સે દર્દ ઐસા દૂર હુવા ગોયા કભી થા હી નહીં ઓર اَلْحَمْدُ لِلّٰہِ عَزَّوَجَلَّ તા હાલ મુઝે દોબારા વોહ તકલીફ નહીં હુઈ ઓર સબ સે બડી સઆદત યેહ મિલી કે મુઝે મ-દની કાફિલે મેં ખ્વાબ કે અન્દર મદીને કે તાજદાર صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કા દીદાર હો ગયા.

લૂટને રહમતેં કાફિલે મેં ચલો સીખને સુન્નતેં કાફિલે મેં ચલો
દર્દેસર હો અગર દુખ રહી હો કમર દર્દ દોનોં મિટેં કાફિલે મેં ચલો
હે તલબ દીદ કી, દીદ કી ઈદ કી કયા અજબ વોહ દિખેં કાફિલે મેં ચલો
સુલ્તાને દો જહાં صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કી કુરબાનિયાં

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! અપની ઓર સારી દુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કે લિયે આપ કો અપને અન્દર કુરબાની કા જઝબા પૈદા કરના હોગા. બિગૈર કુરબાની પેશ કિયે કુછ નહીં હો સકતા. હમારે પ્યારે પ્યારે ઓર મીઠે મીઠે આકા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم ને ઈસ્લામ કી ખાતિર કેસી કેસી કુરબાનિયાં પેશ કીં ઈસ કા તસવ્વુર હી લરઝા દેને કે લિયે કાફી હૈ. રાહે ખુદા عَزَّوَجَلَّ મેં હમારે મક્કી મ-દની આકા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰલِہٖ وَسَلَّم કો બેહદ સતાયા ગયા, આપ صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰલِہٖ وَسَلَّم કી રાહોં મેં કાંટે બિઘાએ ગએ, આપ صَلَّی اللہُ تَعَالٰી عَلَیْہِ وَاٰલِہٖ وَسَلَّم પર પથ્થર બરસાએ ગએ, હત્તા કે કુફરે બદ અત્વાર આપ કો શહીદ કરને કે ભી દરપૈ રહે મગર હમારે પ્યારે પ્યારે આકા ઓર મીઠે મીઠે મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰી عَلَیْہِ وَاٰલِہٖ وَسَلَّم હિમ્મત ન હારે. આપ صَلَّی اللہُ تَعَالٰી عَلَیْہِ وَاٰલِہٖ وَسَلَّم કી મુસલ્સલ જિદો જહદ રંગ લાઈ, જો લોગ દુશ્મન થે વોહ અલ્લાહ عَزَّوَجَلَّ

કરમાને મુસ્તફા : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો લોગ અપની મજલિસ સે અલ્લાહ કે ઝિક્ક ઓર નબી પર દુરુદ શરીફ પઢે બિગૈર ઉઠ ગએ તો વોહ બદબુદાર મુદાર સે ઉઠે. (شعب الإيمان)

કે ફઝલો કરમ સે દોસ્ત બન ગએ, જો જાન કે દરપૈ થે વોહ જાને કુરબાન કરને લગે, જો દૂસરોં કો મુસલ્માન હોને સે રોકતે થે વોહ ખુદ મુસલ્માન હો કર દૂસરોં કો મુસલ્માન કરને કી કોશિશોં મેં મસરૂફ હો ગએ. આજ સારી દુન્યા મેં જો ઈસ્લામ કી બહારેં હૈં વોહ અલ્લાહુ રબ્બુલ ઈઝ્ઝત કી ઈનાયત સે પ્યારે મુસ્તફા صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કી મસાઈયે જમીલા ઓર આપ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કી અઝીમ તરબિયત સે સહાબએ કિરામ عَلَيْهِمُ الرِّضْوَان કી કુરબાનિયોં કા નતીજા હૈ.

હક કી રાહ મેં પથ્થર ખાએ ખૂં મેં નહાએ તાઈફ મેં
દીન કા કિતની મેહનત સે કામ આપ ને એ સુલ્તાન કિયા

(વસાઈલે બખ્શિશ, સ. 388)

صَلُّوا عَلَى الْحَبِيب! صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

ભલાઈ કી બાતેં સિખાને કી ફઝીલત

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! આપ ભી નેકી કી દા'વત કી ખાતિર કુરબાનિયોં કે લિયે કમર બસ્તા હો જાઈયે ઓર ઢેરોં સવાબ કમાઈયે. ઈમામ અબૂ નુએમ અહમદ બિન અબ્દુલ્લાહ અસ્ફહાની قَدَسَ سِرُّهُ النَّوْرَانِي (મુ-તવફફા 430 હિજરી) “હિલ્યતુલ ઔલિયા” મેં નકલ કરતે હૈં, અલ્લાહ તબા-ર-ક વ તઆલા ને હઝરતે સય્યિદુના મૂસા કલીમુલ્લાહ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَام કી તરફ વહ્ય ફરમાઈ : “ભલાઈ કી બાતેં ખુદ ભી સીખો ઓર દૂસરોં કો ભી સિખાઓ, મેં ભલાઈ સીખને ઓર સિખાને વાલોં કી કબ્રોં કો રોશન ફરમાઊંગા તાકે ઉન કો કિસી કિસ્મ કી વહ્શત ન હો.” (حليّة الأولياء ج ٦ ص ٧٢٢٢)

મુબલ્લિગીન કી કબ્રેં إِنَّ شَاءَ اللهُ عَزَّوَجَلَّ જગ-મગાએંગી

ઈસ રિવાયત સે નેકી કી બાત સીખને સિખાને કા અજરો સવાબ મા'લૂમ હુવા. સુન્નતોં ભરા બયાન કરને યા દર્સ દેને ઓર સુનને વાલોં

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : जिस ने मुज पर रोजे जुमुआ दा सो बार दुइदे पाक पढा उस के दो सो साल के गुनाह मुआफ़ होंगे. (جمع الجوامع)

કે તો વારે હી ન્યારે હો જાએંગે, اِنَّ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ, ઉન કી કબ્રે અન્દર સે જગમગ જગમગ કર રહી હોંગી ઔર ઉન્હેં કિસી કિસ્મ કા ખૌફ મહસૂસ નહીં હોગા. ઈન્કિરાદી કોશિશ કરતે હુએ નેકી કી દા'વત દેને વાલોં, મ-દની કાફિલે મેં સફર ઔર ફિકે મદીના કર કે મ-દની ઈન્આમાત કા રિસાલા રોઝાના પુર કરને કી તરગીબ દિલાને વાલોં ઔર સુન્નતોં ભરે ઈજતિમાઅ કી દા'વત પેશ કરને વાલોં નીઝ મુબલ્લિગીન કી નેકી કી દા'વત કો સુનને વાલોં કી કુબૂર ભી اِنَّ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ હુબૂર મુફીઝુનૂર صَلَّی اللّٰهُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم કે નૂર કે સદકે નૂરુન અલા નૂર હોંગી.

કબ્ર મેં લહરાએંગે તા હશર યશમે નૂર કે

જલ્વા ફરમા હોગી જબ તલ્અત રસૂલુલ્લાહ કી

(હદાઈકે બખ્શિશ શરીફ, સ. 152)

જન્મત મેં દાખિલા ઔર ગુઝશતા ગુનાહોં કા કફફારા

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! કિતને ખુશ નસીબ હેં વોહ ઈસ્લામી ભાઈ જો ઈલ્મે દીન સીખને કી નિયત સે મ-દની કાફિલોં મેં સફર કરતે હેં ઉન કે લિયે જન્મત મેં દાખિલે ઔર ગુઝશતા ગુનાહોં કે કફફારે કી બિશારત હૈ. ઈસ ઝિમ્ન મેં દો રિવાયાત સુનિયે ઔર ઝૂમિયે : ﴿1﴾ હઝરતે સય્યિદુના અબૂ સઈદ ખુદરી رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ સે મરવી હૈ : “જો અપને દીન કા ઈલ્મ સીખને કે લિયે સુબહ કો ચલા યા શામ કો ચલા વોહ જન્મતી હૈ.”

(جَلِيَّةُ الْأَوْلِيَاءِ ج ٧ ص ٢٩٥، التيسير بشرح الجامع الصغير لِلْمُنَاوِي ج ٢ ص ٤٣٢)

﴿2﴾ “જો શખ્સ ઈલ્મ કી તલબ કરતા હૈ, તો વોહ ઉસ કે ગુઝશતા ગુનાહોં કા કફફારા હો જાતા હૈ.”

(ترمذی ج ٤ ص ٢٩٤ حديث ٢٦٥٧)

صَلُّوا عَلَيَّ الْحَبِيبِ ! صَلَّی اللّٰهُ تَعَالٰی عَلَیْ مُحَمَّدٍ

ફરમાને મુસ્તફા ﷺ : مَوْلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ મુઝ પર દુરૂદ શરીફ પઢો અલ્લાહ ઈબ્રાહીમ પર રહમત ભેજેગા. (અબુ ડાવુદ)

હુસૂલે દુન્યા કે લિયે સફર.....

ગૌર તો ફરમાઈયે ! લોગ આમદની કી ઝિયાદતી કે લિયે અપને શહર સે દૂસરે શહર, અપને મુલક સે દૂસરે મુલક જા પડતે હૈં ઔર માં બાપ, બાલ બચ્ચોં વગૈરા સે બરસોં દૂર પડે રહતે હૈં. આહ ! આજ હુસૂલે દુન્યા કી ખાતિર અક્સર લોગ હર તરહ કી કુરબાનિયાં દે રહે હૈં મગર ઈસ કદર અઝીમુશ્શાન અજરો સવાબ કી બિશારતોં કે બા વુજૂદ રાહે ખુદા عَزَّ وَجَلَّ મેં ચન્દ રોઝ કે લિયે ભી મ-દની કાફિલે મેં સફર કરને કો તય્યાર નહીં હોતે.

એક તરફ સહાબા કા કિરદાર દૂસરી તરફ હમ ગફલત શિઆર

ઝરા સોચિયે તો સહી ! સહાબએ કિરામ عَلَيْهِمُ الرِّضْوَان ને રાહે ખુદા કે હર સફર મેં બઠ ચઠ કર હિસ્સા લિયા ખ્વાહ વોહ દુશ્મનોં કે મુકાબલે મેં કિતાલ (યા'ની જંગ) કા મુઆ-મલા હો યા ઈલ્મે દીન સીખના સિખાના મક્સૂદ હો. યેહ ઉન્હીં કી કુરબાનિયોં કા સદકા હૈ જો આજ દુન્યા મેં હર તરફ દીને ઈસ્લામ કી બહારેં હૈં, બહર હાલ એક તરફ તો સહાબએ કિરામ عَلَيْهِمُ الرِّضْوَان હૈં જિન કી ઝિન્દગિયાં અલ્લાહ عَزَّ وَجَلَّ કે દીન કી સર બુલન્દી કે લિયે વક્ફ થીં ઔર દૂસરી તરફ હમ ગાફિલ લોગ હૈં જિન કે શબો રોઝ સિફ ઔર સિફ દુન્યા હી કી તરક્કી કે લિયે ગોયા વક્ફ હૈં. આહ ! સદ કરોડ આહ !

વાઈઝે કૌમ કી વોહ પુખ્તા ખયાલી ન રહી ! બર્કે તબઈ ન રહી, શો'લા મકાલી ન રહી
રહ ગઈ રસ્મે અઝાં, રૂહે બિલાલી ન રહી ફલ્સફા રહ ગયા, તલ્કીને ગઝાલી ન રહી

મસ્જિદેં મરસિયા ખ્વાં હેં કે નમાઝી ન રહે

યા'ની વોહ સાહિબે ઔસાફ હિજાઝી ન રહે

હર મુસલ્માં રગે બાતિલ કે લિયે નિશ્તર થા ઉસ કે આઈનએ હસ્તી મેં અમલ જૌહર થા
જો ભરોસા થા ઉસે તો ફકત અલ્લાહ પર થા હે તુમ્હેં મૌત કા ડર, ઉસ કો ખુદા કા ડર થા

કરમાને મુસ્તફા صلى الله تعالى عليه و آله وسلم : મુઝ પર કસરત સે દુરુદે પાક પઢો બેશક તુમહારા મુઝ પર દુરુદે પાક પઢના
તુમહારે ગુનાહોં કે લિયે મફિરત હૈ. (ابن عساکر)

બાપ કા ઈલ્મ ન બેટે કો અગર અઝૂબર હો !

ફિર પિસર કાબિલે મીરાસે પિદર કયૂંકર હો

હર કોઈ મસ્તે મએ જૌકે તન આસાની હૈ કેસા ભાઈ ! તેરા અન્દાઝે મુસલ્માની હૈ ?

હેદરી ફકર હૈ, ને દૌલતે ઉસ્માની હૈ તુમ કો અસ્લાફ સે કયા નિસ્બતે રૂહાની હૈ ?

વોહ ઝમાને મેં મુઅઝઝલ થે મુસલ્માં હો કર

ઔર તુમ ખ્વાર હુએ તારિકે કુરઆં હો કર

તુમ હો આપસ મેં ગઝબ નાક, વોહ આપસ મેં રહીમ તુમ ખતાકારો ખતા બીં, વોહ ખતા પોશો કરીમ

યાહતે સબ હેં કે હોં ઔજે સુરથ્યા પે મુકીમ પહલે વૈસા કોઈ પૈદા તો કરે કલ્બે સલીમ

તખ્તે ફઝૂર ભી ઉન કા થા સરીર કે ભી

યૂંહી બાતેં હેં, કે તુમ મેં વોહ હમિયત હૈ ભી ?

ખુદકુશી શેવા તુમહારા, વોહ ગયૂરો ખુદાર તુમ ઉખુવત સે ગુરેઝાં, વોહ ઉખુવત પે નિસાર

તુમ હો ગુફતાર સરાપા, વોહ સરાપા કિરદાર તુમ તરસતે હો કલી કો, વોહ ગુલિસ્તાં બ કનાર

અબ તલક યાદ હેં કૌમોં કો હિકાયત ઉન કી

નકશ હે સફહએ હસ્તી પે સદાકત ઉન કી

મિસ્લે બૂ કેદ હે ગુન્યે મેં, પરેશાં હો જા રખ્ત બરદોશ હવાએ ય-મનિસ્તાં હો જા

હે તુનુક માયા, તો ઝરેં સે બિયાબાં હો જા નગમએ મૌજ સે હંગામએ તૂકાં હો જા

કુવ્વતે ઈશક સે હર પસ્ત કો બાલા કર દે

દહર મેં ઈસ્મે صلى الله تعالى عليه وسلم મુહમ્મદ સે ઉજાલા કર દે

અકલ હે તેરી સિપર ઈશક હે શમશીર તેરી ! મેરે દરવેશ ! ખિલાફત હે જહાંગીર તેરી

મા સિવા અલ્લાહ કે લિયે આગ હે તકબીર તેરી તૂ મુસલ્માન હે તકદીર હે તદબીર તેરી

صلى الله تعالى عليه وسلم
કી મુહમ્મદ સે વફા તૂને તો હમ તેરે હેં

યેહ જહાં ચીઝ હે કયા લૌહો કલમ તેરે હેં

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

કરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : जिस ने किताब में मुझ पर दुइडे पाक दिभा तो जब तक मेरा नाम उस में रहेगा फिरिश्ते उस के लिये इस्तिफ़ार (या'नी बप्पिशिश की हुआ) करते रहेंगे. (अ. 17)

જોશે ઈમાની કા સુબૂત દીજિયે

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! આપ ભી હિમ્મત કીજિયે ઓર જોશે ઈમાની કા સુબૂત દેતે હુએ અલ્લાહ عَزَّوَجَلَّ કે મહબૂબ, દાનાએ ગુયૂબ, મુનઝૂહુન અનિલ ઉયૂબ صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم ઓર આપ عَلَيْهِمُ الرِّضْوَانُ કી કુરબાનિયોં કો અ-મલી તૌર પર ખિરાજે તહ્સીન પેશ કરને કે લિયે મ-દની કાફિલોં મેં સફર કી નિચ્યત ફરમાઈયે. إِنَّ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ આપ કી રાહોં મેં કોઈ કાંટે નહીં બિછાએગા, આપ પર પથરાવ નહીં કિયા જાએગા. આપ કી રાહોં મેં તો લોગ આંખેં બિછાએંગે.

લૂટને રહમતેં કાફિલે મેં ચલો સીખને સુન્નતેં કાફિલે મેં ચલો
કર્જહોગા અદા, આ કે માંગો દુઆ પાઓગે બ-ર-કતેં કાફિલે મેં ચલો

(વસાઈલે બપ્પિશિશ, સ. 609)

صَلُّوْا عَلٰی الْحَبِیْبِ ! صَلَّی اللّٰهُ تَعَالٰی عَلٰی مُحَمَّدٍ

દાતા હુઝૂર કી તરફ સે મ-દની કાફિલે કી ખેર ખ્વાહી

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! મ-દની કાફિલોં કે મુસાફિરોં પર જો કરમ નવાઝિયાં હોતી હૈં ઉન કી એક ઝલક આપ ભી મુલા-હઝા કીજિયે ઓર ફિર મ-દની કાફિલે મેં આશિકાને રસૂલ કે સાથ સફર કે લિયે કમર બસ્તા હો જાઈયે યુનાન્હે ઈસ્લામી ભાઈયોં કા બયાન હૈ કે હમારા મ-દની કાફિલા મર્કઝુલ ઔલિયા લાહોર દાતા દરબાર કી મસ્જિદ કે અન્દર તીન દિન કે લિયે કિયામ પઝીર થા. હમ મ-દની કાફિલે કે જદ્વલ કે મુતાબિક સુન્નતોં કી તરબિચ્યત હાસિલ કર રહે થે, દૌરાને હલકા એક સાહિબ તશરીફ લાએ ઉન્હોં ને

ફરમાને મુસ્તફા ﷺ: صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ: જો મુઝ પર એક દિન મેં 50 બાર દુરૂદ પાક પઢે કિયામત કે દિન મેં ઉસ
સે મુસા-ફહા કરૂં (યા'ની હાથ મિલાઊ)ગા. (ابن بشكوال)

આશિકાને રસૂલ કે સાથ બડી મહબ્બત કે સાથ મુલાકાત કી ફિર કહને
લગે, اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ આજ રાત મેરી કિસ્મત કા સિતારા ચમકા ઓર
હુઝૂર દાતા ગન્જ બખ્શ અલી હિજવેરી رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ મુઝ ગુનહગાર કે
ખ્વાબ મેં તશરીફ લાએ ઓર કુછ ઈસ તરહ ફરમાયા: “દા’વતે ઈસ્લામી
કે મ-દની કાફિલે વાલે આશિકાને રસૂલ તીન દિન કે લિયે મેરી મસ્જિદ મેં
ઠહરે હુએ હેં લિહાઝા તુમ ઉન કે ખાને કા ઈન્તિઝામ કરો.” લિહાઝા મેં
મ-દની કાફિલે વાલોં કી ખૈર ખ્વાહી કે લિયે ખાના લાયા હૂં આપ
હઝરાત કબૂલ ફરમાઈયે.

क्या गरज दर दर ફिरूं में भीक लेने के लिये है सवामत आस्ताना आप का दाता पिया
ओलियां भर भर के ले जाते हैं मंगते रात दिन હો મેરી ઉમ્મીદ કા ગુલશન હરા દાતા પિયા

(વસાઈલે બખ્શિશ, સ. 507)

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٌ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! બયાન કો ઈખ્તિતામ કી તરફ
લાતે હુએ સુન્નત કી ફઝીલત ઓર ચન્દ સુન્નતેં ઓર આદાબ બયાન
કરને કી સઆદત હાસિલ કરતા હૂં. તાજદારે રિસાલત, શહન્શાહે
નુબુવ્વત, મુસ્તફા જાને રહમત, શમ્મે બઝમે હિદાયત, નોશએ બઝમે
જન્નત صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા ફરમાને જન્નત નિશાન હૈ : જિસ ને મેરી
સુન્નત સે મહબ્બત કી ઉસ ને મુઝ સે મહબ્બત કી ઓર જિસ ને મુઝ સે મહબ્બત
કી વોહ જન્નત મેં મેરે સાથ હોગા.

(ابن عساکر ج ٩ ص ٣٤٣)

सीना तेरी सुन्नत का मदीना बने आका

જન્નત મેં પડોસી મુઝે તુમ અપના બનાના

صَلُّوْا عَلَيَّ الْحَبِيْب! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٌ

ફરમાને મુસ્તફા ﷺ: બરોઝે કિયામત લોગો મેં સે મેરે કરીબ તર વોહ હોગા જિસ ને દુન્યા મેં મુઝ પર જિયાદા દુરુદે પાક પઢે હોંગે. (તરમ્દી)

“કત્એ રેહ્મી હરામ હૈ” કે 13 હુરુફ કી નિસ્બત સે સિલએ રેહ્મી કે 13 મ-દની ફૂલ

❁ ફરમાને ઈલાહી عَزَّ وَجَلَّ 1: **وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ**

તર-જ-મએ કન્ઝુલ ઈમાન : “ઔર અલ્લાહ સે ડરો, જિસ કે નામ પર માંગતે હો ઔર રિશતોં કા લિહાઝ રખો.” ઈસ આયતે મુબા-રકા કે તહત “તફસીરે મઝહરી” મેં હૈ : યા’ની તુમ કત્એ રેહ્મ (યા’ની રિશ્તેદારોં સે તઅલ્લુક તોડને) સે બચો² ❁ 7 ફરામીને મુસ્તફા ﷺ : ﴿1﴾ જો અલ્લાહ ઔર કિયામત પર ઈમાન રખતા હૈ ઉસે યાહિયે કે સિલએ રેહ્મી કરે³ ﴿2﴾ કિયામત કે દિન અલ્લાહ عَزَّ وَجَلَّ કે અર્શ કે સાએ મેં ત્રીન કિસ્મ કે લોગ હોંગે, (ઉન મેં સે એક હૈ) સિલએ રેહ્મી કરને વાલા⁴ ﴿3﴾ રિશ્તા કાટને વાલા જન્નત મેં નહીં જાએગા⁵ ﴿4﴾ લોગોં મેં સે વોહ શખ્સ સબ સે અચછા હૈ જો કસરત સે કુરઆને કરીમ કી તિલાવત કરે, જિયાદા મુત્તકી હો, સબ સે જિયાદા નેકી કા હુકમ દેને ઔર બુરાઈ સે મન્અ કરને વાલા હો ઔર સબ સે જિયાદા સિલએ રેહ્મી (યા’ની રિશ્તેદારોં કે સાથ અચ્છા બરતાવ) કરને વાલા હો⁶ ﴿5﴾ બેશક અફઝલ તરીન સ-દકા વોહ હૈ જો દુશ્મની છુપાને વાલે રિશ્તેદાર પર કિયા જાએ⁷ ﴿6﴾ જિસ કૌમ મેં કાતેએ રેહ્મ (યા’ની રિશ્તેદારી તોડને વાલા) હો, ઉસ (કૌમ) પર અલ્લાહ કી રહમત કા નુઝૂલ નહીં હોતા⁸ ﴿7﴾ જિસે યેહ પસન્દ હો કે ઉસ કે લિયે (જન્નત મેં) મહલ બનાયા જાએ ઔર ઉસ કે દ-રજાત બુલન્દ કિયે જાએ, ઉસે યાહિયે કે જો ઈસ પર ઝુલ્મ કરે યેહ ઉસે મુઆફ

مدینہ
 1: پ ۴۶ التمساء: ۱: تفسیر مظہری ج ۲ ص ۳: بخاری ج ۴ ص ۱۳۶ حدیث ۶۱۳۸: فی ألفردوس
 بمأثور الخطاب ج ۲ ص ۹۹ حدیث ۲۵۲۶: بخاری ج ۴ ص ۹۷ حدیث ۵۹۸۴: سنن الإمام احمد
 ج ۱ ص ۱۰۲ حدیث ۴۰۲: ایضاً ج ۹ ص ۱۳۸ حدیث ۲۳۵۸۹: ألفردوس ج ۲ ص ۱۰۳

ફરમાને મુસ્તફા ﷺ : عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुझ पर एक भरतभा दुइए पढा अल्लाह उस पर दस रइमते भेजता और उस के नामअे आ'माल में दस नेकियां लिખता है. (त्रुण्डी)

करे और जो ईसे मइइम करे येह उसे अता करे और जो ईस से क्त्अे तअल्लुक करे येह उस से नाता (या'नी तअल्लुक) जोडे (الْمُسْتَدْرَك ٣٤ ص ٢٠١٠ احديث ١٠) ❀ डजरते सय्यिदुना इकीह अबुलवैस समर कन्दी عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِي हैं, सिलअे रेइम करेने के 10 इअेदे हैं : अद्लाह एَزَّوَجَلَّ की रिआ हासिल होती है, लोगों की पुशी का सभभ है, इरिशतों को मसरत होती है, मुसल्मानों की तरइ से उस शप्स की ता'रीफ होती है, शैतान को ईस से रन्ज पड़ोयता है, उअ्र बढती है, रिऊक में अ-र-कत होती है, इत हो जाने वाले आभाओ अजदाद (या'नी मुसल्मान बाप दादा) पुश होते हैं, आपस में मइअत बढती है, वफात के बा'द ईस के सवाभ में ईअाफ हो जाता है, क्यूंके लोग उस के डक में दुआअे भैर करते हैं (تَنْبِيْهُ الْغَافِلِيْنَ ص ٧٣) ❀ दा'वते ईस्लामी के ईशाअती ईदारे मक-त-अतुल मदीना की मत्बूआ 1196 सइहात पर मुशतमिल डिताभ, “अडारे शरीअत” जिहद 3 सइहा 558 ता 560 पर है : सिलअे रेइम के मा'ना रिशते को जोडना है या'नी रिशते वालों के साथ नेकी और सुलूक करना. सारी उम्मत का ईस पर ईत्तिफाक है के सिलअे रेइम “वाजिअ” है और क्त्अे रेइम (या'नी रिश्ता तोडना) “अराम” है. जिन रिशते वालों के साथ सिलअे (रेइम) वाजिअ है वोह कौन हैं ? आ'ज उ-लमा ने इरमाया : वोह जू रेइम मअरम हैं और आ'ज ने इरमाया : ईस से मुराद जू रेइम हैं, मअरम हों या न हों. और आहिर येही कौले दुवुम है, अहादीस में मुत्लकन (या'नी बिगैर किसी कैद के) रिशते वालों के साथ सिला (या'नी सुलूक) करने का हुक्म आता है, कुरआने मज्हद में मुत्लकन (या'नी बिला कैद) دَوَى الْقُرْبَى (या'नी कराअत वाले) इरमाया गया मगर येह आत अइर है के रिशते में यूंके

કરમાને મુસ્તફા. عَلَى اللَّهِ تَعَالَى غَيْرُ اللَّهِ وَسَلَّمَ. શબે જુમુઆ ઓર રોજે જુમુઆ મુઝ પર દુરૂદ કી કસરત કર લિયા કરો જો
 એસા કરેગા કિયામત કે દિન મેં ઉસ કા શફીઅ વ ગવાહ બનુંગા. (شعب الإيمان)

મુખ્તાલિફ દ-રજાત હૈં (ઈસી તરહ) સિલએ રેહ્મ (યા'ની રિશ્તેદારોં સે હુસ્ને સુલૂક) કે દ-રજાત મેં ભી તફાવુત (યા'ની ફક) હોતા હૈ. વાલિદૈન કા મર્તબા સબ સે બઢ કર હૈ, ઈન કે બા'દ જૂ રેહ્મ મહરમ કા, (યા'ની વોહ રિશ્તેદાર જિન સે નસબી રિશ્તા હોને કી વજહ સે નિકાહ હમેશા કે લિયે હરામ હો) ઈન કે બા'દ બકિય્યા રિશ્તે વાલોં કા અલા ક-દરે મરાતિબ. (યા'ની રિશ્તે મેં નઝદીકી કી તરતીબ કે મુતાબિક) (رَدُّ الْمُنْتَهَج ٩ ص ١٧٨)

❁ સિલએ રેહ્મી (યા'ની રિશ્તેદારોં કે સાથ સુલૂક) કી મુખ્તાલિફ સૂરતેં હૈં, ઈન કો હદિય્યા વ તોહફા દેના ઓર અગર ઉન કો કિસી બાત મેં તુમ્હારી ઈઆનત (યા'ની ઈમદાદ) દરકાર હો તો ઈસ કામ મેં ઉન કી મદદ કરના, ઉન્હેં સલામ કરના, ઉન કી મુલાકાત કો જાના, ઉન કે પાસ ઉઠના બૈઠના, ઉન સે બાતચીત કરના, ઉન કે સાથ લુટ્ફો મેહરબાની સે પેશ આના (نَوَازِع ١ ص ٣٢٣) ❁ અગર યેહ શખ્સ પરદેસ મેં હૈ તો રિશ્તે વાલોં કે પાસ ખત ભેજા કરે, ઉન સે ખતો કિતાબત જારી રખે તાકે બે તઅલ્લુકી પૈદા ન હોને પાએ ઓર હો સકે તો વતન આએ ઓર રિશ્તેદારોં સે તઅલ્લુકાત તાઝા કર લે, ઈસ તરહ કરને સે મહબ્બત મેં ઈઝાફા હોગા. (رَدُّ الْمُنْتَهَج ٩ ص ١٧٨) (ફોન યા ઈન્ટર નેટ કે ઝરીએ ભી રાબિતે કી તરકીબ મુફીદ હૈ) ❁ સિલએ રેહ્મી (રિશ્તેદારોં કે સાથ અચ્છા સુલૂક) ઈસી કા નામ નહીં કે વોહ સુલૂક કરે તો તુમ ભી કરો, યેહ ચીઝ તો હકીકત મેં મુકાફાત યા'ની અદલા બદલા કરના હૈ કે ઉસ ને તુમ્હારે પાસ ચીઝ ભેજ દી તુમ ને ઉસ કે પાસ ભેજ દી, વોહ તુમ્હારે યહાં આયા તુમ ઉસ કે પાસ ચલે ગએ. હકીકતન સિલએ રેહ્મ (યા'ની કામિલ દ-રજે કા સિલએ રેહ્મ) યેહ હૈ કે વોહ કાટે ઓર તુમ જોડો, વોહ તુમ સે જુદા હોના ચાહતા હૈ, બે એ'તેનાઈ (યા'ની લા પરવાહી) કરતા હૈ ઓર તુમ ઉસ કે

ફરમાને મુસ્તફા ﷺ: صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ: જો મુઝ પર એક બાર દુરુદ પઢતા હો અલ્લાહ ઈસ કે લિયે એક કીરાત અજ લિખતા હો ઔર કીરાત ઉદુદ પહાડ જિતના હો. (અહમદ)

સાથ રિશ્તે કે હુકૂક કી મુરાઆત (યા'ની લિહાઝ વ રિઆયત) કરો. (ایضاً)

હઝારોં સુન્નતેં સીખને કે લિયે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ દો કુતુબ (1) 312 સફહાત પર મુશ્તમિલ કિતાબ “બહારે શરીઅત” હિસ્સા 16 ઔર (2) 120 સફહાત કી કિતાબ “સુન્નતેં ઔર આદાબ” હદિય્યતન હાસિલ કીજિયે ઔર પઢિયે. સુન્નતોં કી તરબિય્યત કા એક બેહતરીન ઝરીઆ દા'વતે ઇસ્લામી કે મ-દની કાફિલોં મેં આશિકાને રસૂલ કે સાથ સુન્નતોં ભરા સફર ભી હો.

લૂટને રહમતેં કાફિલે મેં ચલો સીખને સુન્નતેં કાફિલે મેં ચલો
હોંગી હલ મુશ્કિલેં કાફિલે મેં ચલો ખત્મ હોં શામતેં કાફિલે મેં ચલો

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

ગમે મદીના, બકીઅ,
મસ્કિરત ઔર બે
હિસાબ જન્નતુલ
ફિરદૌસ મેં આકા
કે પડોસ કા તાલિબ



5 સ-ફરુલ મુઝફ્ફર 1435 સિ.હિ.
9-12-2013

યેહ રિસાલા પઢ કર દૂસરે કો દે દીજિયે

શાદી ગમી કી તકરીબાત, ઈજતિમાઆત, આ'રાસ ઔર જુલૂસે મીલાદ વગૈરા મેં મક-ત-બતુલ મદીના કે શાઅએ કદા' રસાઈલ ઔર મ-દની ફૂલોં પર મુશ્તમિલ પેફ્લેટ તક્સીમ કર કે સવાબ કમાઈયે, ગાહકોં કો બ નિચ્ચતે સવાબ તોહફે મેં દેને કે લિયે અપની દુકાનોં પર ભી રસાઈલ રખને કા મા'મૂલ બનાઈયે, અખ્બાર ફરોશોં યા બચ્ચોં કે ઝરીએ અપને મહલ્લે કે ઘર ઘર મેં માહાના કમ અઝ કમ એક અદદ સુન્નતોં ભરા રિસાલા યા મ-દની ફૂલોં કા પેફ્લેટ પહોંચા કર નેકી કી દા'વત કી ધૂમેં મચાઈયે ઔર ખૂબ સવાબ કમાઈયે.

કરમાને मुस्तફا: صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ: જાબ તુમ રસૂલો પર દુરૂદ પઢો તો મુઝ પર ભી પઢો, બેશક મેં તમામ જહાનો કે રબ કા રસૂલ હું. (جمع الجوامع)

ફેહરિસ

ઉન્વાન	સંક્ર્ધ	ઉન્વાન	સંક્ર્ધ
દુરૂદ શરીફ કી ફઝીલત	1	મુબલ્લિગીન કી કબ્રે ۱۱ صَلَاتُ اللَّهِ عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ جગ-મગાએંગી	13
મ-દની મુન્ને કા જોશે ઈમાની	2	જન્નત મેં દાખિલા ઓર ગુઝશતા	
દુન્યા કે લિયે તો વક્ત હૈ મગર.....	5	ગુનાહોં કા કફકારા	14
ચાર શહીદોં કી માં	6	હુસૂલે દુન્યા કે લિયે સફર.....	15
ગુફતાર કે ગાઝી	7	એક તરફ સહાબા કા કિરદાર દૂસરી	
એહસાસે ઝિમ્માદારી પૈદા કીજિયે	10	તરફ હમ ગફલત શિઆર	15
મ-દની કાફિલે મેં શિક્ષા ભી મિલી		જોશે ઈમાની કા સુબૂત દીજિયે	17
ઔર દીદાર ભી હુવા	11	દાતા હુઝૂર કી તરફ સે મ-દની	
સુલ્તાને દો જહાં صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ કી કુરબાનિયાં	12	કાફિલે કી ખૈર ખ્વાહી	17
ભલાઈ કી બાતેં સિખાને કી ફઝીલત	13	સિલએ રેહૂમી કે 13 મ-દની ફૂલ	19

આંકડો

મطبوعه	کتاب	مطبوعه	کتاب
دارالکتب العربی بیروت	تعمیر الغائبین	مکتبۃ المدینہ باب المدینہ کراچی	قرآن مجید
دار المعرفۃ بیروت	الذواجر	کوئٹہ	تفسیر مظہری
دارالکتب العلمیۃ بیروت	سعادۃ الدارین	دارالکتب العلمیۃ بیروت	بخاری
مکتبۃ الامام الشافعی عرب	اتیسیر	دارالفکر بیروت	ترمذی
باب المدینہ کراچی	درر	دارالفکر بیروت	مسند امام احمد
دار المعرفۃ بیروت	رد المحتار	دار المعرفۃ بیروت	المسند رک
شمیر برادر مرکز الاولیاء لاہور	زلف و زنجیر	دارالکتب العلمیۃ بیروت	حلیۃ الاولیاء
مکتبۃ المدینہ باب المدینہ کراچی	حدائق بخشش شریف	دارالفکر بیروت	ابن ہساکر
مکتبۃ المدینہ باب المدینہ کراچی	وسائل بخشش	دارالکتب العلمیۃ بیروت	الفردوس بہا ثور الخطاب
☆☆☆	☆☆☆	دار احیاء التراث العربی بیروت	اسد الغابۃ

दांत थमकाने का नुस्खा

पुश्क आमले पन्सारी की दुकान से ले कर
पिसवा कर पाउडर बना कर शीशी में मलकूल
कर लीजिये, रोजाना सुबह व शाम उंगली
से दांतों को इस से धूब मांजिये. दांत
थमकदार होंगे, धून आता हो तो
वोह भी बन्द होगी और दांत
धूब मजबूत हो जायेंगे.

إِنَّ كَلِمَةَ اللَّهِ عَزَّوَجَلَّ



मक-त-अतुव मदीना

दावले इस्लामी

सिलेक्टेड हाउस, अलिकु की मस्जिद के सामने, तीन दरवाजा, अहमदशाह-1 गुजरात, इन्डिया
Mo.091 93271 68200 E-mail : maktabahmedabad@gmail.com www.dawateislami.net